

પત્રક -૧

: - લોક સંવાદ સેતુ અંતર્ગત મળેલ અરજીઓ :-

તાલુકો :- માણાવદર

જિલ્લો :- જુનાગઢ

ક્રમ	અરજદારનું નામ	અરજી ની બાબત	સંબંધિત કચેરી / વિભાગ	નિકાલ ની કક્ષા	રીમાર્ક્સ
૨૬	મનસુખભાઈ રવજીભાઈ ટીલવા મુ.ગડવાવ , મોબાઇલ નં.૯૯૨૫૫૭૬૧૩૯	ખેતીવાડી ઇલેક્ટ્રિક કનેક્શન ની માંગણી તા.૨૫.૧૦.૧૯૯૩ થી કરેલ છે જે મંજૂર થયેલ છે અને પાછળથી ઈરાદા પૂર્વક રદ કરેલ છે તે મૌખિક જણાવે છે તો માફ મંજૂર થયેલ કનેક્શન મને તાત્કાલિક આપવા મારી અરજ છે. (સર્વે નં.૯૨/૨)	માણાવદર-૨ / પીજીવીસીએલ	નિતી વિષયક	સદરહું બાબતે અરજદાર ની રજૂઆત મુજબ અરજદાર ની ૨૫.૧૦.૧૯૯૩ ની અરજી નો રેકોર્ડ તપાસતા સર્વે નં.૯૨/૨ માં કોઈ કનેક્શન ની માંગણી નથી પરંતુ ૨૫.૧૦.૧૯૯૩ ની અરજી સર્વે નં. ૯૧/૨ માં કરેલ છે તેમજ સર્વે નં. ૯૧/૨ નું સર્વે કરતાં સદર સર્વે નં. ના સંયુક્ત ખાતેદારો મનસુખભાઈ રવજીભાઈ ટીલવા વગેરે (પાંચ) તેના ખેતર માં આવેલ કૂવા ઉપર સંયુક્ત ખાતેદારો પૈકીના નામે એટલે કે વલ્લભભાઈ રાવજીભાઈ,ગ્રાહક નં.૮૪૮૦૯/૦૦૨૮૫/૩ થી ૭.૫ હે.પાવર નું વિજ જોડાણ ધરાવે છે આથી પ્રવર્તમાન નિયમાનુસાર એક જ સર્વે નંબર માં બીજું વીજ જોડાણ આપી ન શકાય.

ક્રમ	અરજદારનું નામ	અરજી ની બાબત	સંબંધિત કચેરી / વિભાગ	નિકાલ ની કક્ષા	રીમાર્ક્સ
૨૫	વલ્લભભાઈ રવજીભાઈ ટીલવા મુ.ગડવાવ , મોબાઇલ નં.૯૯૨૫૩૩૫૭૦૮	ખેતીવાડી ઇલેક્ટ્રિક કનેક્શન મંજૂર થઈ ગયેલ છે કોટેસન ભરેલ છે છતાં લાંબા સમયથી ઇલેક્ટ્રિક કનેક્શન પીજીવીસીએલ દ્વારા આપવામાં આવતું નથી તો તુરંત કનેક્શન આપવા વિનંતી છે. (સર્વે નં. ૯૮/૩)	માણાવદર-૨ / પીજીવીસીએલ	નિકાલ	<p>અરજદાર એ તેની વર્ષ ૧૯૯૫ ની તેની મૂળ જમીન સર્વે નંબર ૯૧/૨ ની માંગણી મૂળ જગ્યા ના બદલે તા.૧૮.૦૬.૨૦૧૩ ના રોજ તેની અન્ય જમીન સર્વે નંબર ૯૮/૩ પૈકી ૨ ઉપર મેળવવા અરજી કરેલ.જે માંગણી મુજબ અરજદારે તા.૦૨.૦૧.૨૦૧૪ ના રોજ ભાવપત્રક ભરપાઈ કરેલ.સ્થળ ઉપર કામ કરવા જતાં શ્રી દિનેશભાઈ દેવશીભાઈ ટીલવા તથા ગોવિંદભાઈ વશરામભાઈ રતનપરા દ્વારા વાંધો લેતા આ કેસ ને સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટશ્રી,વંથલી સમક્ષ રજૂ કરતાં કેસ નં.૦૮/૧૪ નું તા.૨૨.૧૦.૨૦૧૪ ના રોજ ચુકાદો આપેલ કે રી-સર્વે કરી ભવિષ્યમા કોઈને નુકસાન ન થાય તે રીતે વીજ લાઇન ઉભી કરવાનો હુકમ કરેલ. જે મુજબ જુનીયર ઈજનેર તેમજ નાયબ ઈજનેર દ્વારા વારંવાર સ્થળ સમાધાન સ્વરૂપ રી-સર્વે કરવા ગયેલ તથા લાઇન ઉભી કરવા પ્રયત્ન કરેલ પરંતુ વાંધા યથાવત રહેતા લાઇન ઉભી થઈ શકેલ નહીં.</p> <p>હાલ અન્ય અરજદારો ની નવી ઉભી કરાયેલી ૧૧ કેવી લાઇન અરજદારના સેઢા પર ઉભી થતા અરજદારને વિજ જોડાણ આપવાની કામગીરી ચાલુ કરેલ છે. અને તા.૧૮.૦૫.૧૬ ના રોજ સદર વીજ કનેક્શન નું મીટર લગાડવા જતાં સ્થળ પર ઓરડી અથવા કોઈ વાયરીંગ જોવા મળેલ નહી આથી અરજદાર ને નવો ટેસ્ટ રીપોર્ટ આપવાની નોટીસ આપેલ છે અને અરજદાર દ્વારા નવો ટેસ્ટ રીપોર્ટ ઓફીસ ના જમા કરાવ્યા બાદ સદર કનેક્શન રીલીઝ કરવામાં આવશે.</p>

ક્રમ	અરજદારનું નામ	અરજી ની બાબત	સંબંધિત કચેરી / વિભાગ	નિકાલ ની કક્ષા	રીમાર્ક્સ
૩૧	મગનભાઈ હંસરાજભાઈ માકડીયા મુ. ગળવાવ તા. માણાવદર મો.નં. ૯૯૭૯૪૩૭૦૬૨	ખેતીવાડી કનેક્શન ક્વોટેશન તા. ૩૧.૦૩.૨૦૧૬ ના રોજ ભરેલ છે છતાં હજુ સુધી કનેક્શન મળેલ નથી	માણાવદર-૨ / પીજીવીસીએલ	પ્રગતિ હેઠળ ૩૦/૦૬/૨૦૧૬	સદર અરજદાર નું ભાવપત્રક ૩૧.૦૩.૨૦૧૬ ના રોજ ભરપાઈ કરેલ છે તેમજ સદર વીજ-કનેક્શન માટે અરજદાર દ્વારા કરારનામું ૩૧.૦૩.૨૦૧૬ ના રોજ કરવામાં આવેલ. સદર ખેતીવાડી વીજ કનેક્શન આપવા માટે ૨૯૦ મીટર ભારે દબાણ ની લાઇન તથા એક ૧૦ કેવીએ નું ટ્રાન્સફોર્મર સેન્ટર ઊભૂ કરવું પડે તેમ છે. વિશેષમાં અરજદારનું વીજ કનેક્શન અગ્રતા ક્રમ મુજબ ૪૩૩ મો વારો છે અને હાલ ૪૨૧ સુધી કાર્ય પૂર્ણ કરેલ છે આથી આ કામ તા. ૩૦/૦૬/૨૦૧૬ સુધીમાં પૂર્ણ કરવામાં આવશે.